



**Vidhyayana - ISSN 2454-8596**

An International Multidisciplinary Peer-Reviewed E-Journal

[www.j.vidhyayanaejournal.org](http://www.j.vidhyayanaejournal.org)

Indexed in: ROAD & Google Scholar

---

## **ભારતમાં સિંચાઈ પિકાસ અને તેના પ્રશ્નો**

લુણાગરીયા રસિક એસ.

એમ.એ.એમ.ફિલ (અર્થશાસ્ત્ર)

**G-SET- 2018**



## ૧. પ્રસ્તાવના:

માનવ સંસ્કૃતિના મૂળ કૃષિ સંસ્કૃતિ છે. માનવીની ઉકાંતિનાં સમયથી વર્તમાનના વૈશ્વીકરણ ના યુગ સુધી કૃષિ ક્ષેત્રનો ફાળો વિશ્વના આર્થિક વિકાસમાં મહત્વનો રહ્યો છે. આઈકાળથી માનવી ની બધી જરૂરિયાતો ખેતીક્ષેત્રે પૂરી કરતું આવ્યું છે. કોઈપણ વિકસીત, વિકાસશીલ કે અલ્પવિકશીત રાજ્યના ભૂતકાળને તપાસતાં દરેક રાજ્યના વિકાસના મૂળમાં કૃષિ મધ્યસ્થ સ્થાને રહેલું છે. વિશ્વના દરેક રાજ્યનો આર્થિક વિકાસમાં કૃષિક્ષેત્રે કરોડરજીજુ સમાન પુરવાર થયું છે.

ભારતના વિકાસનો ઇતિહાસ તપાસતાં કૃષિક્ષેત્ર અગ્રસ્થાને રહ્યું હતું. જે આજે પણ ૧૨૫ કરોડની ઉપરની વસ્તી માટે કરોડરજીજુ તરીકે જોવા મળે છે. પ્રશ્ન એ છે કે કૃષિક્ષેત્રનું આટલું મહત્વ નું છે, તો તેના વિકાસ અને જાળવણી માટે શું? ખેતીક્ષેત્રે વિકાસ અને કૃષિઉત્પાદન વધારવા માટે કૃષિનિયજકો (ઉત્પાદનના સાધનો) પાયાનું સ્થાન ધરાવે છે. જ્યાં પાક સંરક્ષણ અંગેના પગલાં, ખેડાણ ઘટક જંતુનાશક દવાઓ ટેકનોલોજી, સિંચાઈ, રાસાયણિક ખાતર, વીજળી, ધિરાણ વ્યવસ્થા વગેરે અગત્યના ઉત્પાદનના ઘટકો છે. ભારતની દાખિકોણથી જોઈએ તો આજે પણ લગભગ ૫૦% વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે, આથી આર્થિક વિકાસમાં તેમજ આર્થિક સમસ્યાના ઘટાડામાં આ વસ્તી મહત્વની છે. જેનો આધાર માત્રને માત્ર આ કૃષિ નિયોજકોનો વપરાશ પર છે. કૃષિ નિયજકોનાં વધારાથી રોજગારીનું સર્જન કૃષિનિકાસમાં વધારો, ભાવ સપાઠીમાં સ્થિરતા, ઉદ્યોગોનાં કાચા માલની પ્રાપ્તિ, દેશના આર્થિક વિકાસમાં વધારો, આર્થિક અસમાનતા ઘટાડવા, હરિયાળી કાંતિની સફળતા વગેરે ક્ષેત્રે તેની હક્કારાત્મક અસરો પડે છે.

કૃષિ નિયજકોની અન્ય સાધનોની સિંચાઈ અગત્યનું સ્થાન ધરાવે છે. સિંસાઈ એકમાત્ર ઉત્પાદનનું એવું સાધન છે જેના દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય તેમ છે. ૨૦ મી સદીની મહત્વની માનવ સિધ્ધીઓમાંથી હરિયાળી કાંતિ એક છે જેના મૂળમાં સિંચાઈ પાયાનું સ્થાન ધરાવે છે.

## ૨. ભારતમાં સિંચાઈ વિકાસ:

ભારતમાં આર્થિક વિકાસ માટે કૃષિ વિકાસ અને કૃષિ વિકાસ માટે સિંચાઈનો વિકાસ થવો



જરૂરી છે. ભારતમાં ૧૯૫૦-૫૧ માં ૧૮ % વિસ્તારને સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જે હાલમાં ૨૦૦૪-૨૦૦૫ પ્રમાણે ૪૦.૧૮ % વિસ્તારને સિંસાઈ હેઠળ આવરી લેવામાં આવે છે. સિંચાઈ શબ્દ પાણી સાથે સંકળાયેલો છે. વરસાદ પર આધાર રાખે છે દેશમાં દર વર્ષ ૩૦૦ કરોડ એકર ફૂટ (૪૦ કરોડ હેક્ટર મીટર) પાણી દ્વારા પડે છે. જેમાં ૨૪૦ કરોડ એકર ફૂટ પાણી નદી, તળાવ અને જમીન ઉપર રહે છે.

ભારતમાં સિંચાઈમાં મુખ્ય સ્ત્રોતો વરસાદ, કુવાઓ, તળાવો, નદીઓ, સરોવરો, ઝરણાઓ અને ભૂગર્ભ જળ છે, આમાં વરસાદ એ મોટામાં મોટો સ્ત્રોત છે. બાકીના સ્ત્રોતો પણ વરસાદ પર આધારિત છે. ભારતમાં ખેતી ક્ષેત્રના ૭૦ % ખેડૂતો સિંચાઈ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે, જે કુલ પાણીના વપરાશનો ૮૦ % ભાગ છે.

આગામી બાદ આર્થિક-વિકાસ માટે ખેતીક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આથી વધતી વસ્તી અને દેશની અન્નની માંગ દિવસે દિવસે વધતી હતી, જેને પહોંચી વળવા ખેત ઉત્પાદન વધારવું આવશ્યક હતું, જેને ધ્યાનમાં લઈ પંચવર્ષીય યોજનાની શરૂઆતથી સિંચાઈને આપવામાં આવ્યું હતું.

### ૩. આયોજનકાળ અને સિંચાઈનો પિકાસ:

સિંચાઈનો ઘ્યાલ ભારત માટે નવો નથી. આયોજન કાળ પહેલાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી જે વાવેતર વિસ્તારની ૧૭.૮ % જેટલી હતી. તેમાં પણ મુખ્યત્વે વરસાદ, નહેરો અને કુવાઓ દ્વારા સિંચાઈ થતી હતી. ભારતમાં ભૌગોલિક દાઢિકોણથી દરેક રાજ્યોની વાવેતર કે સિંચાઈ વિસ્તાર જુદો જુદો હતો અને તે રીતે પંચવર્ષીય યોજનામાં દરેક રાજ્યને સિંચાઈ માટે મૂડી રોકાણ ખર્ચ જુદો જુદો જોવા મળતો હતો.

આયોજનના શરૂઆતમાં સિંચાઈની સુવિધા અલ્પ હતી. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન તેની પાછળ મૂડીરોકાણ ખર્ચ વધ્યો, સાથે સાથે વાવેતર વિસ્તાર પણ વળવા પામ્યો એટલે કે ચોખ્યા વાવેતર વિસ્તારની ૧૮.૧ % અને એકંદરે વાવેતર વિસ્તારની ૧૮.૩ % જમીનમાં સિંચાઈ થતી હતી. જે સંચિત વિસ્તારમાં ૨૮.૧ % અને એકંદરે વાવેતર વિસ્તારની ૧૮.૩ % જમીનમાં સિંચાઈ



થતી હતી. જે સંચિત વિસ્તારમાં ૨૮.૧ % અને એકંદરે સિંચિત વિસ્તારમાં ૧.૮૨ % નો વધારો સૂચવે છે. સમયાંતરે સિંચિત વિસ્તારમાં સામાન્ય વધારો થતો રહ્યો, જે ૧૯૮૦-૮૧ માં ચોખ્ખા વાવેતર વિસ્તારની ૩૩.૬ % જમીનમાં અને એકંદરે વાવેતર વિસ્તારની ૩૪.૦૩ % જમીનમાં સિંચાઈની સવલતો ઉપલબ્ધ હતી. જે એક દાયકા બાદ અને ખાસ કરીને ૧૯૮૧ ની ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વીકરણ (LPG) ની નિતિ અપનાવ્યા બાદ વર્ષ ૨૦૦૦-૦૧ દરમિયાન ચોખ્ખા વાવેતર વિસ્તારની ૩૮.૦૩ % જમીનમાં અને એકંદરે વાવેતર વિસ્તારની ૪૦.૬૫ % જમીનમાં સિંચાઈની સવલતો ઉપલબ્ધ હતી. જે વધીને વર્ષ ૨૦૦૫-૦૬ માં ચોખ્ખા વાવેતર વિસ્તારની ૪૨.૪૮ % જમીનમાં અને એકંદરે વાવેતર વિસ્તારની ૪૨.૮૬ % જમીનમાં સિંચાઈની સવલતો ઉપલબ્ધ છે.

આમ, આયોજનકાળ દરમિયાન અને આજાદીના પાંચ દાયકા બાદ પણ માત્ર ૫૦ % વિસ્તારનેજ આવરી શક્યા છે ૧૯૫૦ માં દેશની વસ્તી ત૫ કરોડ હતી જે આજે ૨૦૧૫માં ૧૨૫ કરોડની લગભગ થઈ જયારે પાણીનો જથ્થો તેનો તેજ રહ્યો, પાણી વાપરનાર વધ્યા, અન્ન માટે આપણે બીજા દેશમાંથી આયાત કરવી પડે છે.

ટૂંકમાં સિંચિત વિસ્તાર વધારવા સાથે તેની પાછળનો ઝર્યમાં ટકાવારી ઘટાડો થયો છે. પરંતુ વાસ્તવિક વધ્યું છે.

## ૪. ભારત રાજ્યોમાં ચોખ્ખો અને કુલ સંચિત વિસ્તાર:

ભારતમાં દરેક રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોવાથી દરેક રાજ્યોની સિંચાઈ હેઠળ વિસ્તારમાં મોટો તફાવત છે. ૧૯૭૧-૭૨ માં જોઈએ તો, ચોખ્ખો વિસ્તાર સૌથી વધારે ૭૨.૫ % સાથે પંજાબમાં જોવા મળે છે, અને સૌથી ઓછો સંચિત વિસ્તાર ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં ૮ % જેટલો જોવા મળે છે. જયારે બાકીના રાજ્યોમાં સરેરાશ ઉપ % જેટલો જોવા મળે છે, જયારે કુલ સંચિત વિસ્તારમાં પણ પંજાબ અને ૭૬.૫ % સાથે અગ્રતા ઘરાવે છે. જયારે ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ ત્રિપુરા વગેરે રાજ્યોમાં કુલ સંચિત વિસ્તારની સરેરાશ ૮ થી ૮ % જોવા મળે છે. જયારે અહીં મુખ્ય બાબત એ છે કે મધ્ય પ્રદેશ



મહારાષ્ટ્ર અને કણ્ણાટક સ્થિતિ ખરાબ રહી છે. જેનું કારણ ત્યાની ભૌગોલિક પરિસ્થિતિ, બીજું કે સિંચાઈ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ, જ્યાં મોટા ભાગે વરસાદી પાણી પર આધાર જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિ ગુજરાત અને રાજસ્થાનની પણ હતી જે સુધારા તરફ જઈ રહ્યું છે. ગુજરાતમાં સિંસાઈ પ્રોજેક્ટનો ભરપુર લાભ લેવામાં આવ્યો છે. પંજાબ અને હરિયાણા વધુ સારી નદીઓનો લાભ પહેલે થી જ મળ્યો છે, આથી ત્યાં સિંચાઈના પ્રશ્નોના ઓછા છે. દક્ષિણમાં તમિલનાડું અને કેરાલામાં પરિસ્થિતિ સારી છે.

## ● સિંચાઈના સ્ત્રોતો :

ભારતમાં આજે પણ લગભગ ૫૦ % વસ્તી ગામડામાં રહે છે અને જેઓ ખેતી ઉપર નિર્ભર છે તેમની પાસે જીવનનિર્વાહ માટે માત્ર કૃષિ ઉત્પાદકતા પર આધાર રાખવો પડે છે. આ સંજોગોમાં ખેતી માટે જરૂરી પાણી મેળવવા માટે મુખ્યત્વે બે સ્ત્રોતો છે.

૧. વરસાદ દ્વારા કુદરતી રીતે પ્રાપ્ત થતું પાણી
૨. ભુગર્ભપાણીના સ્ત્રોત દ્વારા થતું પાણી.

ભારતમાં સિંચાઈનો પહેલો સ્ત્રોત અનિયમિત તથા ચોક્કસ છે. વરસાદનું પાણી મોટે ભાગે નદીઓમાં વહીને સમુદ્રમાં ભણી જાય છે થોડે ઘણો અંશો નદીઓ પર તેમો બાંધી વરસાદી પાણીનો સંગ્રહ સિંચાઈ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત તળાવો, ઝરણાં, સરોવરમાં સંગ્રહ થાય છે.

એક અભ્યાસ મુજબ સરકારનું સેન્ટ્રલ વોટર કમીશન પ્રમાણે વર્ષ દરમિયાન વહી જતું પાણી ૧૮૫૦ ઘન મીટર જેટલું છે. દેશની પાંચ મોટી નદીઓનું પાણી.

**ટેબલ : ભારતની મોટી નદીઓનું વહી જતું પાણી**

નદીનું નામ	વહી જતું પાણી ઘન મીટરમાં
ગંગા	૫૦૧
બ્રહ્મપુત્રા	૫૩૭
ગોદાવરી	૧૧૮
ક્રિષ્ણા	૫૮
મહાનદી	૫૭
કાવેરી	૨૧



## Sources : અભિવ્યક્તિ

જ્યારે પાતાળમાંથી પાણીની પ્રાપ્તિ એટલે કે ભૂર્ગબજળ જે પણ વરસાદી પાણી સાથે સંકળાયેલું છે. આધુનિક સમયમાં આ સ્ત્રોતનો વધુ ઉપયોગ જોવા મળે છે. પરંતુ કુદરતી વરસાદ સાથે સંકળાયેલી મુખ્ય સ્ત્રોતોમાં નહેર, તળાવો, ફૂવાઓ, ટેન્ક જેનો વિકાસ સરકાર દ્વારા સિંચાઈને ઉત્તેજન આપવા માટે કરવામાં આવે છે.

સિંચાઈ સ્ત્રોતમાંથી સૌથી વધુ ઉપયોગ ફૂવાઓનું પ્રમાણ લગભગ ૫૫.૬૮ % જેટલું છે.

જ્યારે કુલ સિંચાઈ સ્ત્રોતોના ત૨.૦૪ % નહેરોનું પ્રમાણ છે. તળાવોનું પ્રમાણ ૫.૮ % અને અન્ય સ્ત્રોતોનું ૬.૪૭ % જેટલું છે. નહેરોમાં પણ સરકારી નહેરનું પ્રમાણ ખાનગી કરતાં વધુ ઊચા પ્રમાણમાં જોવા મળે છે. જે નિર્દ્દશ કરે છે કે કેન્દ્ર બજેટ ફાળવણીમાં સિંચાઈ પાછળનો ખર્ચ મોટેભાગે સરકારી નહેરોની પાછળ કરવામાં આવે છે જેની ખાનગી નહેર પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે.

જ્યારે ભારતમાં ગામડાનું પ્રમાણ ઊચુ હોય ત્યાં સિંચાઈ ઉપરાંત પીવાનું પાણીનો પ્રશ્નો વિકટ હોય છે, હાલમાં પાતાળ ફૂવાઓ (TUBEWELLS) નું પ્રમાણ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ ૧૮૭૦–૭૧ માં પાતાળ ફૂવાનું પ્રમાણ ૧૪.૪ % હતું જે ૨૦૦૫–૦૬ માં ૩૮.૫૮ % માં જોવા મળે છે.

તળાવોનું પ્રમાણ જે આયોજનના શરૂઆતના ગાળામાં ૧૭.૨ % હતું. ત્યારબાદ ઉત્તરોત્તર ઘટતાં વર્ષ ૨૦૦૫–૦૬ માં ૩૨.૩૮ % જેટલું જોવા મળે છે. તળાવોમાં પાણી મોટેભાગે વરસાદી પાણી પર નિર્ભર રહે છે અને તે અચોકકસ છે વધુમાં ગરમીનું પ્રમાણ વધતાં પાણીનું બાધીભવન વધુ ઝડપી થાય છે અને તે સુકાય જાય છે.

રાજ્યવાર સિંચાઈ સ્ત્રોતો ભારતમાં કુલ સિંચિત વિસ્તાર લગભગ ૪૦ % જેટલો જોવા મળે છે જેમાં ઉત્તરના રાજ્યોમાં જ્યાં સિંચિત વિસ્તારનું પ્રમાણ વધે છે આથી સિંચાઈ સ્ત્રોતોમાંથી કયા સ્ત્રોતોનું પ્રમાણ કયા રાજ્યમાં વિકસાવવું તે સરકાર માટે મહત્વનું પ્રશ્ન છે. કારણ કે દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે જ્યાં નદીનું પ્રમાણ વધુ ત્યાં નહેરો વિકસાવવી જ્યાં



વરસાદ ઓછો ત્યાં નાના નાના બંધો બનાવી તળાવની વ્યવસ્થા કરવી ટૂંકમાં રાજ્યવાર સિંચાઈના સ્ત્રોતો નીચે ટેબલ પ્રમાણ અભ્યાસ કરતાં તમિલનાડું, આંધ્રપ્રદેશ આસામ, મહારાષ્ટ્ર અને કેરેલા જે પાંચ રાજ્યોમાં સિંચાઈ માટે સૌથી વધુ તળાવનો ઉપયોગ કરવામાં આવે છે.

જમ્બુ અને કશ્મીર ૮.૮૫ %, આસામ ૫૩.૩ %, હરિયાણા ૪૫.૩ %, ઓરિસ્સા ૪૨.૬ % અને કણ્ણાટક ૩૫.૫૨ % માં સૌથી વધુ નહેરોનાં સ્ત્રોતોનો સિંચાઈ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાત રાજ્યસ્થાન, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં, સૌથી વધુ કુવાનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

રાજ્યોમાં સિંચાઈના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે પરંતુ સૌથી વધુ ક્યા સ્ત્રોતોનો ઉપયોગ કરવો તે જે તે રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ પર નિર્ભર છે, આમ છતાં સરકારના દ્વારા પ્રયત્નો હોય છે કે સિંચિત વિસ્તારમાં એક થી વધુ પાક લઈ શકાય તે રીતે સિંચાઈ સ્ત્રોતોની વ્યવસ્થા કરવામાં આવે છે.

## ● ભારતમાં સિંચાઈ તથા જળ વિદ્યુત શક્તિની યોજનાઓ:

કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સિંચાઈ મહત્વનું પાસું છે નદીઓમાં વહી જતું પાણીનો સંગ્રહ કરવો તે દેશ કૃષિ અર્થતંત્રની યોજનાઓ દ્વારા કરવામાં આવે છે વધુમાં વીજશક્તિ માટે પણ અત્યંત ઉપયોગી પરિબળ ગણવામાં આવે છે. પાણી પુરવઠો જેટલે અંશે વધુ ખેતપેદાશમાં વધારે તેમજ સિંચિત વિસ્તારમાં પણ વધારો શક્ય બનશે વિદ્યુતશક્તિના ઉત્પાદન દ્વારા કૃષિ વિભાગમાં વૈવિધ્યકરણ લાવી અને બિનકૃષિ વિભાગનો દર પણ વધારી શકાશે તફુપરાંત આવી યોજના ઓવરે પૂર નિયંત્રણ પુનઃશક્ય બને છે.

બ્રિટિશ શાસન દરમ્યાન વીસમી સદીના પ્રારંભ સમયે (૧૮૦૧) માં સિંચાઈ કમિશનની નિમણૂંક એ ભારતમાં સિંચાઈ વિકાસમાં મહત્વનું સોપાન ગણી શકાય. આ કમિશનની કેટલીક ભલામણોનો સ્વીકાર જાણો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને પંજાબમાંથી પસાર થતીહ સિદ્ધુ, ગંગા, જમુના અને મહી નદીમાંથી મોટી નહેરો ખોદવામાં આવી હતી ત્યારે ઘણાં મહત્વનાં પ્રોજેક્ટ અને સુધારાઓ જોવા મળ્યા જેનો કિઝરાજ સાગર નિઝામ સાગર (A.P.) કેનાલ અને સકકર



બેરેજ અન બન્ને હવે પાકિસ્તાનમાં છે વગેરેને ધરવામાં આવેલી હતી. આયોજનના પ્રારંભથી જ મોટી સિંચાઈ યોજનાઓ નદી કે ખીંચ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી.

- (૧) ભાખરા નાંગલ્ય યોજના : જે ભારતની સૌથી મોટી બહુહેતુક નદી ખીંચ યોજના તરીકે જાણીતી છે. જે જે સતતલજ નદી પર ૭૪૦ ફૂટ ઉચ્ચો બંધ ભાખરા પાસે બાંધવામાં આવેલો છે. આ બંધ થકી પરદ્ય કિ.મી લાંબી મુખ્ય નહેરો બાંધવામાં આવેલી છે. આ નહેરો વડે પંજાબ અને પંજાબ અને હરિયાણા એ બે રાજ્યનો મોટે ભાગના જલ્દ્દાઓને બારેમાસ સિંચાઈનું પાણી પુરું પાડે છે. જેથી આ રાજ્યોને દેશના અનાજના કોઈએ કહેવામાં આવે છે. અંતે કેનાલ ૧૭૭ કિ.મી.ની સાથે વિશ્વની સૌથી લાંબી નહેર છે જેના દ્વારા ૨૩.૭ લાખ હેક્ટર જેટલો વિસ્તાર આવરી લેવાય છે.
- (૨) બિયાસ યોજના : આ યોજના પંજાબ હરિયાણા જે કેન્દ્ર સરકારી સહાયનું સિંચાઈ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ છે જેમાં લગભગ ૧૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે. બિયાસ યોજના દ્વારા વિદ્યુતશક્તિનું પણ નિર્માણ થયું હતું અને બિયાસ બધું સિંચાઈ માટે હોય રાજ્યસ્થાનને કેનાલ દ્વારા જોડી શિયાળમાં પણ પાણી પુરું પાડવામાં આવે છે.
- આયોજનના દ્વારા પંજાબ હરિયાણા અને રાજ્યસ્થાનમાં કુલ ૨૧ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા છે.
  - ઉપરાંત બિયાસ સંકુલ દ્વારા લગભગ ૧૦૧૮ મેગાવોટ વિજણિશક્તિનું ઉત્પાદન અંદાજવામાં આવે છે.
- (૩) દામોદર ખીંચ યોજના : બિહાર અને પશ્ચિમ બંગાળમાં દર વર્ષ દામોદર નદીના પુરથી મોટું નુકસાન થતું હતું. જે અટકાવવા માટે આ યોજના ઘડવામાં આવી હતી. આ યોજનામાં ૪ જગ્યાએ બંધ બાંધવામાં આવ્યાં હતા. સિંચાઈ ઉપરાંત આ યોજનાથી ત્રણ થર્મલ પાવર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.
- આ યોજનાથી કુલ ૩.૨૫ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેક્ટર આવરી લેવામાં આવ્યાં હતાં. જેનાથી પ્રતિ વર્ષ બે સરેરાશ રૂ. ૧૫ કરોડનો વધુ પાક મેળવવી શકતો હતો. આ યોજનાથી મત્સ્ય ઉદ્યોગ અને આ વિસ્તાર કોલસો, તાંબુ જેવા ખનીજોથી ભરપૂર છે અને વિજણી સસ્તી મળતાં આર્થિક વિકાસ માટે અહીં ઉજ્ઝી તકો ઉપલબ્ધ છે.



- (४) **તुँगभद्रा યોજના:** કૃષ્ણા નદીની શાખા તુંગભદ્રા પર ૭૮૪૨ ફુટ લાંબો અને ૧૬૫ ફુટ ઉચ્ચો બંધ ૧૮૫૮ માં પૂર્ણ થયો હતો. તેમની સાથે ૨૭૭ કી.મી લાંબી ડાબા કિનારાથી ઉછલ કી.મી લાંબી ઉચ્ચા સપાઠી પરની અને ૧૮૬ કી.મી લાંબી ઊચી સપાઠી પરની નહેરો બાંધવામાં આવી છે. – ૩૭.૮૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં ૮૦ લાખ એકંદરે ફુટ જેટલા પાણીનો સંગ્રહ કરવામાની શક્તિ ધરાવતું તેનું જળાશય કુલ ૩.૬૫ લાખ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈ માટે પાણીનો પૂરવઠો પાડે છે.
- (૫) **કોસ્ટિ યોજના:** નેપાળથી બહારમાં પસાર થતી કોસી નદી પર ૩.૬૮.૩ કરોડ ખર્ચ આ યોજના પાર પાડવામાં આવેલી છે. સિંચાઈ વિસ્તારને બચાવવા અને પૂરને નિયંત્રણમાં રાખવું જે આ યોજનાનો મુખ્ય હેતું છે. આ યોજનાથી બિહારની ૨.૦૨ લાખ હેક્ટર જમીનને સંરક્ષણ મળતાં તે હવે જોડાણ હેઠળ છે. આ યોજનાથી બિહાર મોટા ભાગના સિંચિત વિસ્તારમાં નહેરો અને કુવાઓ સિંચાઈ સરળ બની છે.
- (૬) **કોયના યોજના :** કૃષ્ણા નદીના ઉપશાખા જે લગભગ ૨૦૦ ફુટ ઊચ્ચો બંધ બાંધી ત્રણ પાવર સ્ટેશનનો ઊભા કરવામાં આવ્યાં હતા. જે પુના તથા મુંબઈ તથા મહારાષ્ટ્રના અન્ય વિભાગો વિજણી અને સિંચાઈની સગવડો પૂરી પાડે છે.
- (૭) **હીરાકુંડ યોજના :** મહાનદી પર ૪૧.૮૦૦ કી.મી લાંબો અને ૧૫૦ ફુટ ઊચ્ચો બંધ બાંધવામાં આવેલ છે. આ યોજના બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કેનાલો, જળાશય તથા પાવર ખર્ચ કરવામાં આવ્યો ત્યાર બાદ બીજા તબક્કામાં આજ હેતુસર વધારાનો ખર્ચ કરી કુલ ૨૭૦ મેગાવૉટ વીજણીનું ઉત્પાદન અને લગભગ ૪ લાખ હેક્ટર જેટલા જમીનને સિંચાઈ નો લાંબી મળી શકશે.
- (૮) **ચંબલ ખીજા યોજના:** મધ્યપ્રદેશ અને રાજ્યસ્થાનને જોડતી ચંબલ નદીના પાણી પર ત્રણ તબક્કામાં આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે. જેમાં ગાંધીનગર બંધ, રાણપ્રતાપ સાગર બંધ અને જવાહર સાગર બંધ બાંધવામાં આવેલ છે. ઉપરાંત ત્રણ બંધો પર પાવર હાઉસ પણ બનાવવામાં આવેલ છે. જે આ બંને રાજ્યોની કુલ ૫.૬૬ લાખ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ આપે છે. જેને કારણે કપાસ અને ઘઉના ઉત્પાદનમાં ઘડ્યો મોટો ફાયદો થયો છે. રાજ્યસ્થાનમાં પાણી પુરવઠો મળતાં



ઘણાં લાભો મળ્યાં છે.

- (૮) સરદાર સરોવર યોજના: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના ૧૯૮૭ માં શરૂ કરવામાં આવેલી છે. ગુજરાતની જીવાદોરી તરીકે જાણીતી બનેલી આ યોજનાથી ઉચ્ચાઈ રૂપરૂપ ફૂટની છે. આ યોજનાથી પાણીનો પુરવઠો સંગ્રહ ચાર રાજ્યોને પીવાનું પાણી ઉપરાંત સિંચાઈ માટેનું પાણી કેનાલ દ્વારા પુરું પાડવામાં આવશે. આ યોજનાથી આદિવાસી વિસ્તારને જમીન વિહોંશો થવાથી વિવાદસ્પદ બની હતી. પરંતુ મુખ્ય કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી તેનો લાભો ભવિષ્યમાં ખૂબ સારા પ્રમાણમાં મળવાપાત્ર છે.

ઉપરોક્ત દેશની મુખ્ય બહુ હેતુ યોજના હોય જે સિંચાઈ તથા જળવિધુત ઉત્પાદનમાં વધારો કરી દેશના અર્થકરણમાં વિકાસ પ્રેરકમ પરિબળોને સબળ ટેકો આપે છે. આ ઉપરાંત દેશમાં નાગાર્જુન સાગર, મધુકુંડ, સૈલમ ડેમ, કાકરાપાર, પરામિયકુલમઅલિયાર, મહીકડાણાં મયુરાશિ, વગેરે યોજનાઓ પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન ઘડવામાં આવેલી છે. જેનાથી ભારતમાં જુદા—જુદા વિસ્તારમાં તથા વિધુત શક્તિના લાભો સુલભ થયો.

## ● ભારતમાં સિંચાઈના પ્રશ્નો:

ભારતમાં સિંચાઈ હેઠળ વિસ્તાર વધારવા માટે વિકાસ કાર્યક્રમો અને વિવિધ પ્રકારની સિંચાઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. પરિણામે સિંચાઈની ક્ષમતા વધી છે. પરંતુ કેટલાંક કારણોસર સિંસાઈની ઉપલબ્ધ સંગવડો અને તેનો ખરેખર ઉપયોગ વચ્ચે ઉણપ રહે છે.

- (૧) ભારતમાં સિંચાઈ શક્તિમાં જેટલો વધારો થયો છે તેટલો વાસ્તવમાં જોવા મળતો નથી જે માટે જુદાં જુદાં જવાબદાર હોઈ શકે ખેડૂતો આર્થિક સ્થિતિ નબળી હોવાથી સિંચાઈ પાણીનો લાભ પૂરતો પ્રાપ્ત કરી શકતો નથી.
- (૨) સરકારની વિવિધ યોજના વચ્ચે સંકલ્પનના અભાવે ખેડૂતોને યોગ્ય સમયે જરૂરિયાત મુજબનો પાણી પૂરવઠો પહોંચાડી શકતી નથી.
- (૩) સિંચાઈનું પાણી મેળવવા માટે નક્કી કરવામાં આવેલા ભાવ ઘણાં ઉચ્ચા હેવાથી સીમાંત ખેડૂતો



તેનો લાભ લઈ શકતા નથી તથા દુરના વિસ્તારો સુધી પાણીનો પુરવઠો પહોંચાડવા માટે નહેરોની શાખા—પ્રશાખા બાંધવામાં ઘણો વિલંબ થાય છે. ઉપરાંત ઉચ્ચી જમીન પર સિંચાઈના પાણી પહોંચાડવા યંત્ર સામગ્રીનો અભાવ અથવા ઉચ્ચી કિંમત હોવાથી નાના અને સિમાંત બેડૂતો એ સિંચાઈથી વંચિત રહેવું પડે છે.

- (૪) સરકારની ધિરાણની નીતિનો લાભ મોટેભાગે બેડૂતો લેતાં હોય છે. નાના મધ્યમ અને સીમાંત બેડૂતોને ધિરાણ ઓછું અથવા વંચિત જોવા મળે છે. વધુમાં નાની મધ્યમ અને મોટી સિંચાઈ યોજનાઓ વચ્ચે શુસ્કુલ ન હોવાથી સિંચાઈનો વાસ્તવિક ઉપયોગ થઈ શકતો નથી.
- (૫) પાણીનો દુર ઉપયોગ એટલે કે ભારતમાં પાણીના આયોજનનો અભાવ હોવાને કારણે સિંચાઈ હેઠળ ની જમીન ઓછી જોવા મળે છે. નદીનું પાણી સમુક્રમાં અને નહેરનું પાણી પણ પુરતી વ્યવસ્થા ન હોવાથી નદીમાં વહી જતું હોય છે.
- (૬) ભારતમાં જમીન વિસ્તારનો જ્યાં પેટાળમાં જથ્થો વિસ્તૃત છે પરંતુ તેને બહાર લાવવા ટેકનોલોજી અને મુડી રોકાણની જરૂર હોય છે જે સામાન્ય બેડૂતો માટે પહોંચની બહાર છે.
- (૭) પાણીનો બફર સ્ટોક ઊભો કરવાનો પ્રશ્ન પણ વિકટ છે, કારણ બંધ બાંધવાથી પર્યાવરણ ઉપરાંત લોકોની જમીન અને પુનઃવસવાટનો પ્રશ્ન મોટે બની જતો હોય છે ઘણી વખત રાજ્યનૈતિક કારણોને લીધે પણ મોટી યોજનાઓ કે બંધ મુશ્કેલીમાં મુકાતા હોય છે.


ખેતીક્ષેત્રેના વિકાસમાં અને કૃષિઉત્પાદન વધારવા માટે કૃષિનિપજકો (ઉત્પાદનના સાધનો) પાયાનું સ્થાન ધરાવે છે. જ્યાં પાક સંરક્ષણ અંગેના પગલાં ખેડાણ ઘટક, જંતુનાશક દવાઓ, ટેકનોલોજી સિંચાઈ, રાસાયણિક ખાતર, વિજણી, ધિરાણ વ્યવસ્થા વગેરે અગત્યના ઉત્પાદનના ઘટકો છે જેના વપરાશમાં થતો વધારો ખેતઉત્પાદન અને ખેતઉત્પાદકતામાં વધારો લાવે છે. કૃષિ નિપજકોના વધારો થી રોજગારી સર્જન, કૃષિનિકાસમાં વધારો, આર્થિક અસમાનતા ઘટાડવા, હરિયાણી કાંતિની સર્જણતા વગેરે ક્ષેત્રે તેની હકારાત્મક અસરો પડે છે. કૃષિ નિપજકોની તુલનામાં સિંચાઈ અગત્યનું સ્થાન ધરાવે છે, સિંચાઈ એકમાત્ર ઉત્પાદનનું એવું સાધન છે. જેના દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય તેમ છે. ૨૦ મી સદીની મહત્વની માનવ સિદ્ધિઓમાંની હરિયાણી કાંતિ એક છે જેના મૂળમાં સિંચાઈ પાયાનું સ્થાન ધરાવે છે.



ગુજરાતમાં અર્થતંત્રમાં પણ ખેતી અને ઉધોગ બે અગત્યના પાયા છે. ગુજરાત સામાન્ય રીતે ઉધોગ પ્રધાન રાજ્ય તરીકે ગણાય છે પરંતુ ખેતી ક્ષેત્રનું પણ એક અગત્યનું સ્થાન રહ્યું છે અને ખેતી ના વિકાસ માટે સિંચાઈ એક અગત્યનું પાસું છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજના, ઉકાઈ કાકરાપાર યોજના, દમણગંગા, કરજણ યોજના, મહી અને ફાતવાડી યોજના, Dharoi, વાંકાબોરી અને કડાણા જેવી વિવિધ યોજનાઓ ગુજરાતના ખેતી વિકાસ માટે પ્રયોજાયેલી જોવા મળે છે, તેમજ કલ્પસર યોજના જે Gulf Of Khambhat પર પ્રયોજવામાં આવશે અને જેનાથી મોટા પાયા પર ગુજરાત ના ખેતી ક્ષેત્ર પર હકારાત્મક અસરો પહોંચશે, ગુજરાતમાં સિંચાઈ વિસ્તારોને વિસ્તારથી વિભાગીત કરીએ તો તેને કેનાલ (Canal), tank, કુવા (Including Tubewell) અને અન્ય સ્ત્રોત (ખેતી તલવાડી, બોરબંધ, ચેકડેમ વગેરે) નો સમાવેશ થાય છે રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ, નાની અને મોટી સિંચાઈ યોજનાઓ અમલીકરણમાં જોવા મળે છે.

## સમાપન:

ભારત આજે પણ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, જ્યાં ૫૦ % વસ્તી કૃષિક્ષેત્રે પર આધારિત છે. ખેતી માટે ખાતર, પાણી, સિંચાઈ એ મહત્વની બાબત ગણી શકાય ખેતીને સમુદ્ધ બનાવવા વધુમાં વધુ જમીન સિંચાઈ સૌથી મહત્વનું અંગ ગણાય છે. કૃષિક્ષેત્રે ટેકનોલોજીનું માળખાગત પરિવર્તન લાવવા માટે સિંચાઈ ક્ષમતા અને તેની ઉપયોગિતાનું પૂરતું ધ્યાન આપવાની ખૂબ જરૂરિયાત છે. એક સમ એવો હતો કે જ્યારે નવી સિંચાઈ યોજનાનો અમલમાં આવી રહી હતી, જવાહરલાલ નહેરું એ તેને આધુનિક ભારતનાં નવાં તીર્થસ્થાનો તરીકે ઓળખાવી હતી. ધીરે ધીરે આ દિશામાં મૂડીરોકાણ ઘટતું ગયું અને આજે ૫ દાયકા પછી પણ માત્ર ૪૦ % ખેતીને જ સિંચાઈનો લાભ મળે છે. છતાં એ વાત સ્વીકારવી રહી કે દેશના આશરે ૫૫ % લોકોના સિંચાઈનો લાભ મળે છે. છતાં એ વાત સ્વીકારવી રહી કે દેશના આશરે ૫૫ % લોકોના જીવન નિર્વાહનો આધાર સીધી કે આડકતરી રીતે ખેતી ઉપર છે. સરકારના પ્રયાસો હજુ અપૂરતાં રહ્યા છે. પરંતુ એક સંતોષની બાબત એ છે કે વૈશ્વિક મંદી છતાં પણ ૫ % આસપાસ આર્થિક વિકાસનો દર આપણે સાચવી



રાખ્યો છે.

→ સંદર્ભસૂચિ:

- (1) <https://guj-NWRS.gujarat.gov.in>
- (2) <https://gwssb.gujrat.gov.in>
- (3) gujecostat.gujarat.gov.in
- (4) gujarat Domestic water supply (protection) Rules-2020
- (5) Jalshakti-ddws.gov.in
- (6) <https://wasmo.gujarat.gov.in>
- (7) [www.cenvsindia.gov.in-2011](http://www.cenvsindia.gov.in-2011)
- (8) ગુજરાત માનવ વિકાસ વિઝન
- (9) ગુજરાત જલદિશા
- (10) જોશી, ભાસ્કર હ. ભારતનું કૃષિક્ષેત્ર: વિકાસ અને પડકાર, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ  
બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર